



ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ

“રાજીવ ગાંધી ભવન” સંસ્કાર કેન્દ્ર માર્ગ, વી.એસ. હોસ્પિટલ પાસે, એલિસબ્રીજ, અમદાવાદ-૩૮૦૦૦૬.
ફોન : ૦૭૯-૨૬૫૭૮૨૧૨-૨૧૩, ૨૬૫૭૮૧૬૧, ૨૬૫૭૮૩૧૧ ફેક્સ : ૦૭૯-૨૬૫૭૮૫૮૯

Web : www.incgujarat.com

E-mail : gpcc1234@gmail.com

અખબારી યાદી

તા. ૪-૨-૨૦૨૩

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી અને વડગામનાં કોંગ્રેસ પક્ષનાં ધારાસભ્યશ્રી જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે દુનિયાનું સૌથી મોટું કોર્પોરેટ સ્કેમ દેશમાં ચાલી રહ્યું છે. તાજેતરમાં ટ્વીટર પર 'ચોકીદાર હી ચોર હૈ' હેસ્ટેગ ટ્રેન્ડીંગ થઈ રહ્યું છે. હિડનબર્ગ રિપોર્ટને પગલે દેશમાં આર્થિક સંકટ ઉભું થયું છે. અદાણી ગ્રુપના સ્કેમ અંગે સીબી, ઈડી, સીબીઆઈ, આરબીઆઈ કેમ ચૂપ છે. કોંગ્રેસ પક્ષ નાના અને મધ્યમ વર્ગનાં ઉદ્યોગકારો સાથે છે. શેલ કંપનીઓ-ફેક કંપનીઓ ઉભી કરીને કરોડો રૂપિયાની ટેક્ષ ચોરી કરવામાં આવી છે અને શેરમાં રોકાણ કરવામાં આવ્યું છે. દેશની સૌથી વિશ્વસનીય વીમા કંપની દ્વારા ૭૬૦૦૦ કરોડનું અને એસબીઆઈ સહિતની બેન્કોએ ૮૦૦૦૦ કરોડનું રોકાણ અદાણી ગ્રુપમાં કરવામાં આવ્યું છે. જે રીતે શેર માર્કેટમાં એલઆઈસી અને વિવિધ બેંકોનાં રોકાણનું ધોવાણ થયું છે એ ખૂબ જ ચિંતાનો વિષય છે. ગુજરાતની ભાજપ સરકાર પણ 'મગનું નામ મરી' પાડતી નથી. ગુજરાતનાં રોકાણકારને સાચવવા માટે એક શબ્દ ભાજપ સરકાર ઉચ્ચારતી નથી ત્યારે કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે આ સમગ્ર ગોટાળાની તાપસ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ દ્વારા તાપસ કરવામાં આવે.

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી બિમલભાઈ શાહએ જણાવ્યું હતું કે દેશનાં અને ગુજરાતનાં લાખો લોકોએ પોતાના જીવનની મૂડી સરકારી વીમા કંપની એલઆઈસી અને સરકાર બેંકોમાં રોકાણ કરે છે. અદાણી ગ્રુપના આર્થિક ગોટાળા અને હિડનબર્ગનાં રિપોર્ટ બાદ રોકાણકારોનાં તેમજ સરકારી સંસ્થાઓનાં કરોડો રૂપિયા ધોવાઈ ગયા છે. ત્યારે તારીખ ૬ ફેબ્રુઆરી બપોરે ૧ વાગે કોંગ્રેસ પક્ષ ગુજરાતનાં તમામ જિલ્લા મથકે અને અમદાવાદમાં એલઆઈસી ઓફીસ બહાર ધારણા-પ્રદર્શન કરી વિરોધ કરવામાં આવશે. તારીખ ૭ ફેબ્રુઆરીએ કોંગ્રેસ પક્ષ દ્વારા હાથ સે હાથ જોડો યાત્રાનો શુભારંભ કરવામા આવશે. પદયાત્રાની શરૂઆત સાબરમતી આશ્રમ ખાતેથી કરવામાં આવશે. ગુજરાતમાં વારંવાર પેપર ફૂટવાની ઘટનાના અંગે ગુજરાતનાં યુવાનોને સાથે મળીને લાખો યુવાનોના ભવિષ્ય માટે આ યાત્રામાં યુવાનોની રોજગારીનાં પ્રશ્ને મજબૂતાઈથી ઉજગર કરવામાં આવશે.

પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી અને પ્રવક્તાશ્રી હિરેન બેંકર ઉપસ્થિત રહ્યાં હતાં.

હિરેન બેંકર
પ્રવક્તા